

# ਇਸਤੀਨੇ ਬਚਾਵੋ!



ਦਰਦੀਨੇ ਸ਼ਾਸਕਤ ਰਹੇਵਾਮਾਂ  
ਮਦਦ ਕਰੋ.

# હાડકાંને મજબૂત કરવા



ચિત્રોનો ઉપયોગ માંત્ર દર્શાવત હેતુસર કરવામાં આવ્યો છે, આ વાસ્તવિક દર્શીઓ નથી.

## અનુક્રમણિકા

|   |   |
|---|---|
| ■ ઓસ્ટીઓપોરોસિસ   | 2 |
| ■ ઓસ્ટીઓપોરોસિસ શું છે?   | 2 |
| ■ ઓસ્ટીઓપોરોસિસ ધરાવતા દરદીઓ શું ફરિયાદ<br>કરે છે?                                    | 3 |
| ■ ઓસ્ટીઓપોરોસિસ કોને થઈ શકે છે?   | 4 |
| ■ તમને ઓસ્ટીઓપોરોસિસ છે એ તમારા ડૉક્ટર કઇ<br>રીતે નક્કી કરે છે?                       | 6 |
| ■ શું તમારે બીએમડી પરીક્ષાએ કરાવવું જોઈએ?   | 6 |
| ■ ઓસ્ટીઓપોરોસિસને લીધે થતી જાટિ<br>લતાઓ કર્દી છે?                                     | 7 |
| ■ એકવાર નિદાન થયા પછી શું ઓસ્ટીઓપોરોસિસની<br>સારવાર થઈ શકે છે?                        | 7 |
| ■ ઓસ્ટીઓપોરોસિસ સાથે જીવન: ઓસ્ટીઓપોરોસિસની<br>જાટિલતાઓ તમે કર્દી રીતે ઓળી કરી શકો છો? | 7 |



## ઓસ્ટીઓપોરોસિસ

ઓસ્ટીઓપોરોસિસ એટલે “છિક્રાણુ હાડકાં”

ઓસ્ટીઓપોરોસિસને લીધે હાડકાં નબળા અને બટકણાં થઈ જાય છે, એટલાં બટકણાં કે વળવું, કોઈ વસ્તુ ઉચ્ચકવી અથવા ખાંસી ખાવા જેવી હળવી તાણ માત્રથી ફેક્ચર થઈ શકે છે. ઓસ્ટીઓપોરોસિસનું સામાન્ય પરિણામ છે ફેક્ચર, જે વધુ કરીને સ્પાઇન (કરોકરજજુ), હિપ (થાપા) અથવા રિસ્ટ (કાંડા)માં થાય છે. આ ધારું ખરું મહિલાઓને થતો રોગ માનવામાં આવે છે તેમ છતા અનેક પુરુષો પણ આનાથી પ્રભાવિત થાય છે.



## ઓસ્ટીઓપોરોસિસ શું છે?

હાડકું એક સજ્જુપ ઉતક (ટિશ્યૂ) છે જે સતત બદલાતું રહે છે, નવું હાડકું બને છે અને જૂનું હાડકું ટૂટી જાય છે, આ પ્રક્રિયા રીમોડેલિંગ અથવા બોન ટર્નઑવર કરેલાય છે.

તમે ચુવાન હો ત્યારે તમારું શરીર જૂનું હાડકું તોડ એનાથી વધુ ઝકપે નવું હાડકું તૈયાર કરે છે અને તમારા બોન માસમાં વૃદ્ધિ થાય છે. ગ્રીસની ઉમરના દાયકામાં તમારું બોન માસ સૌથી વધારે હોય છે. ત્યારાપણી, હાડકાનું રીમોડેલિંગ સતત થતું રહે છે, પરંતુ તમે નવું તૈયાર થાય એની તુલનાએ વધુ ગુમાવો છો. રણ્ણનિપૃત્તિ વખતે જ્યારે ઓફિસ્ટ્રોજન (માદા હાર્મોન) સ્તરમાં ઘટાડો થાય છે ત્યારે સ્વીઓમાં હાડકાની ક્ષિતિમાં નાટ્યાત્મક વધારો જોવા મળે છે. ઓસ્ટીઓપોરોસિસ થવાનું તમારું જોખમ તમે 25 અને 35 (સર્વોચ્ચ બોન મોસ) વર્ષની ઉમર વચ્ચે કેટલું બોન માસ મેળવો છો અને પછી તે કેટલું ઝકપથી ગુમાવો છો તેના પર આધાર રાખે છે. તમારું સર્વોચ્ચ બોન માસ જેટલું વધારે હોય એટલું વધુ હાડકું તમારી પાસે રહેશે અને વધતી ઉમર સાથે તમને ઓસ્ટીઓપોરોસિસ થવાની સંભાવના પણ ઓછી રહેશે.



## ઓસ્ટીઓપોરોસિસ ધરાવતા દરદીઓ શું ફરિયાદ કરે છે?

ઓસ્ટીઓપોરોસિસને “સાયલંટ કિલર” તરીક પણ ઓળખવામાં આવે છે કારણ કે હાડકાની ક્ષતિ કોઈ લક્ષણો વિના થાય છે. લોકોને ઓસ્ટીઓપોરોસિસ થયાનું ત્યાં સુધી ખબર નથી પડતી જ્યાં સુધી તેમને એકાએક તાણા, ઝટકો અથવા પડી જવાને લીધે વર્ટીબ્રા (પીઠનું હાડકું) અથવા અન્ય હાડકાનું ફેક્ચર ન થાય.


હાડકાની ક્ષતિના શરૂઆતના તબક્કાઓમાં, સામાન્ય રીતે તમને કોઈ જ દુખાવો અથવા અન્ય લક્ષણો નથી થતા. પરંતુ એકવાર ઓસ્ટીઓપોરોસિસને લીધે હાડકાં નબળા થયા પછી તમે આ ફરિયાદી ધરાવી શકો છો જેમાં સામેલ છે:

- **પીઠ દર્દ,** જે તીવ્ર હોઈ શકે છે જો અગાર તમને વર્ટીબ્રાનું ફેક્ચર હોય અથવા તે કોલેપ્સ થયું હોય.
- સમય જતા ઉંચાઈ ઘટી જવી અને ખૂંદ્ય દેખાવી.



## ઓસ્ટીઓપોરોસિસ કોને થઈ શકે છે?

કેટલાંક પરિબળો તમને ઓસ્ટીઓપોરોસિસ થવાની સંભાવનામાં વધારો કરી શકે છે, જેમાં સામેલ છે:



### તમારી લિંગ

ઓસ્ટીઓપોરોસિસને લીધે થતા ફેક્ચર્સ પુરુષોમાં છે એની તુલનાએ મહિલાઓમાં બમળા પ્રમાણમાં સામાન્ય જોવા મળે છે.

### તમારી ઉંમર

જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ ઓસ્ટીઓપોરોસિસ થવાનું તમારું જોખમ વધતું જાય છે. વધતી ઉંમર સાથે તમારા હાડકાં નબળા થતા જાય છે.



### પારિવારિક ઈતિહાસ

ઓસ્ટીઓપોરોસિસ વારસાગત છે. એટલે, માતા-પિતા અથવા ભાઈ બણેનને ઓસ્ટીઓપોરોસિસ હોવાથી તમને પણ તે થવાનું જોખમ વધી જાય છે, ખાસ કરીને જો તમે પણ ફેક્ચર્સનો પારિવારિક ઈતિહાસ ધરાવતા હો.

### કેટલીક દવાઓ


અસ્થિમા, રુમેટોઇડ આર્થ્રોઇટિસ (સંધિવા), સોરિયાસિસ ઇત્યાદિ રિસ્થિતિઓની સારવાર માટે સામાન્ય જણાતી દવાઓનો લાંબા સમય સુધી કરાતો ઉપયોગ.



### ધૂમ્રપાન

ધૂમ્રપાન હાડકાની રચના કરતા કોખોના કાર્યને અવરોધે છે અને ઓસ્ટીઓપોરોસિસ થવાના જોખમમાં વધારો કરે છે.





### કલ્લિયમનું ઓછું સેવન

કલ્લિયમનું ઓછું સેવન હાડકાની નબળી ધનતા,  
હાડકાને વહેલો ધસારો લાગવો અને ફેક્ચરના વધુ  
જોખમનું કારણ બને છે.



### કોનિક આલ્કોહોલિક્ઝમ

આલ્કોહોલનું વધુ પડતું સેવન હાડકાની રચનામાં  
ઘટાડો કરે છે અને કલ્લિયમ ગ્રહણ કરવાની  
શરીરની ક્ષમતામાં હસ્તક્ષેપ કરે છે.




### વહેલી રજોનિવૃત્તિ

જો તમે શાટ્રકિયા દ્વારા અંડાશથ કાઢી નાખવાને  
લીધે 45 વર્ષની ઉંમર પહેલા રજોનિવૃત્તા થાઓ.



### જટિલ રોગો

જો તમે રૂમેટોઇડ આર્થ્રોઇટિસ (સંધિવા), હાઈપરથા-  
ઇરોડિક્ઝમ જેવા રોગોથી પીડાતા હો તો તમને  
ઓસ્ટીઓપોરોસિસ થવાનું જોખમ વધુ રહે છે. આ માટે  
તમારા ડૉક્ટરની સલાહ લો.



## તમને ઓસ્ટીઓપોરોસિસ છે એ તમારા ડૉક્ટર કઈ રીતે નક્કી કરે છે?

ઓસ્ટીઓપોરોસિસના કોઈ સ્પષ્ટ ચિહ્નો ન હોવાથી, હાડકાંની મજબૂતી વિશે જાણવાની એક ભાત્ર રીત તમારી બોન મિનરલ ડેન્સિટી (બીએમડી) માપવી એ છે.

તમે ધરાવો છો એ વિકલ્પોમાં સામેલ છે:

### 1. ચુઅસેઝુ

આ એક સાંદું પરીક્ષણ છે જે પગની એડી અને કાંડા પાસે બોન મિનરલ ડેન્સિટી (બીએમડી) માપે છે. આ ઓસ્ટીઓપોરોસિસ માટેનું સ્ક્રીનિંગ પરીક્ષણ છે.

### 2. કયુઅલ એનેજિં એક્સ-રે અબ્સોર્પ્ટિઓમેટ્રી (ડેક્સા)

આ તમારા શરીરના જુદા જુદા ભાગો જેમ કે તમારી કરોડરજુ અને થાપા પાસે નીએમડી માપે છે.

ડેક્સા ઓસ્ટીઓપોરોસિસના નિદાન માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. તે ઓસ્ટીઓપોરોસિસના નિદાનની પુષ્ટિ કરવામાં મદદ કરે છે. આ પરીક્ષણ ડક્પી અને દર્દ રહિત હોવા સાથે તેમાં રેડિએશનનો ઉપયોગ ઘણો ઓછો થાય છે.

ફેક્ચર રિસ્ક એસેસમેન્ટ (ફેક્સ) અથવા 1 મિનિટ ઓસ્ટીઓપોરોસિસ રિસ્ક પરીક્ષણ પણ કરવામાં આવી શકે છે, જેનાથી ભવિષ્યમાં ઓસ્ટીઓપોરોસિસ ફેક્ચર થવાના જોખમ વિશે જાણી શકાય છે.

## શું તમારે બીએમડી પરીક્ષણ કરાવવું જોઈએ?

નીચેની પરિસ્થિતિઓમાં તમારે ડૉક્ટરને મળીને બીએમડી પરીક્ષણ કરવા વિચારવું જોઈએ:

- તમારી ઉંમર 65 વર્ષથી વધુ હોય, જોખમી પરિબળોને ધ્યાનમાં ન લેતા.
- તમે રજોનિપૃત્ત થઈ ગયા હો અને ઓસ્ટીઓપોરોસિસ માટે ફેક્ચર થયેલ હાડકું ધરાવવા સહૃદત ઓછામાં ઓછું કોઈ એક જોખમી પરિબળ ધરાવતા હો.
- તમે એવી દવાઓનો ઉપયોગ કરતા હો જેને લિધે ઓસ્ટીઓપોરોસિસ થાય છે.
- તમે ડાયાબિટીસ, લીવરનો રોગ, કિડનીનો રોગ, થાઇરોઇડ રોગ અથવા ઓસ્ટીઓપોરોસિસનો પારિવારીક ઇતિહાસ ધરાવતા હો.
- તમને વહેલી રજોનિપૃત્ત થાય.



## ઓસ્ટીઓપોરોસિસને લીધે થતી જટિલતાઓ કઈ છે?

ફેક્ચર્સ એ ઓસ્ટીઓપોરોસિસની વારંવાર થતી અને ગંભીર જટિલતા છે. આ સામાન્ય રીતે તમારી સ્પાઇન અથવા હિપમાં થાય છે. થાપા (હિપ)ના ફેક્ચર્સ સામાન્ય રીતે પડી જવાને લીધે થાય છે. પડી જવાથી થતા કાંડાના ફેક્ચર્સ પણ સામાન્ય છે. કેટલાંક કિસાઓમાં, પડી જવા અથવા ઈજા થથા વગર પણ સ્પાઇનલ (કરોકરજ્જુ)નું ફેક્ચર થઈ શકે છે જેનું કારણ એ છે કે તમારી પીઠ (વાર્ટિબ્રા)માં રહેલું હાડકું એટલું નબળું પડી જાય છે કે તે સંકુચિત થવા લાગે છે. જો તમે આવા અનેક ફેક્ચર્સ ધરાવતા હો તો તમારી ઉંચાઈ અનેક ઈંધ્ય ઘટી શકે છે અને તમારા શરીરમાં ખૂંધ જોવા મળે છે.

## એકવાર નિદાન થયા પછી શું ઓસ્ટીઓપોરોસિસની સારવાર થઈ શકે છે?

અનેક દવાઓ ઉપલબ્ધ છે જે કંલિયાયમ અને વિટામિન ડી સાથે સંયોજનમાં લેવામાં આવે તો બોન ડેન્સિટી જાળવી રાખે છે અથવા તો તેમાં વધારો પણ કરે છે. આ દવાઓ વિશે વધુ જાણવા કૃપા કરી તમારા ડૉક્ટરને પૂછો.

## ઓસ્ટીઓપોરોસિસ સાથે જીવન: ઓસ્ટીઓપોરોસિસની જટિલતાઓ તમે કઈ રીતે ઓછી કરી શકો છો?

જો તમે ઓસ્ટીઓપોરોસિસ ધરાવતા હો તો હાડકાંને થતું વધુ નુકસાન ટાળવામાં મદદ કરવા સાથે ફેક્ચર થતા ટાળવું પણ એટલું જ અગત્યનું છે.

અનેક પરિબળો છે હાડકાંને સ્વસ્થ બનાવવામાં યોગદાન આપે છે.

### વ્યાયા:

વ્યાયામ પડી જવાનું જોખમ ઓછું કરે છે કેમ કે તે સ્નાયુઓને મજબૂતી આપે છે, લવચિકતામાં વધારો કરે છે તેમ જ સમન્વય અને સંતુલનમાં વધારો કરે છે. નિયમિત શારીરિક પ્રવૃત્તિ લાંબા સમય સુધી કરતા રહેવાથી હાડકાની તંદુરસ્તીના લાભો જળવાઈ રહે છે.



વજન ઉચ્કવાનો વ્યાયામ હાડકાની તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે. આ પ્રકારના વ્યાયામોમાં સામેલ છે ચાલવું, જોગિંગ, દાદરા ચઢવા, એરોબિક્સ ઇત્યાદિ. તમે પસંદ કરો એ વ્યાયામ તમારી ઉંમર અને સ્વાસ્થ્ય સ્થિતિને અનુકૂળ આવે એવો હોય એ અગત્યનું છે. ઓસ્ટીઓપોરોસિસ અથવા અગાઉ ફેક્ટ્યર થયેલા લોકોએ કોઈ વ્યાયામ કાર્યક્રમ અપનાવતા પહેલા પોતાના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

## પદ્ધય આહાર અને જીવનશૈલી

આપણે કરીએ છીએ એ આહારની પસંદગી સ્વાસ્થ્ય પર દીર્ઘકાળીન અસર ધરાવી શકે છે. આરોગ્યપ્રદ અને સંતુલિત આહાર લેવાથી ઓસ્ટીઓપોરોસિસનું જોખમ ઘટી જાય છે એ એક સારો પુરાવો છે.

## કંલિશાયમ અને વિટામિન ડી આવશ્યકતા

કંલિશાયમ અને વિટામિન ડી હાડકાની તંદુરસ્તી માટે બે સૌથી અગત્યના પોષકતત્ત્વો છે. જીવનમાં કંલિશાયમ અને વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મેળવ્યું ખૂબ આવશ્યક છે, જેથી મજબૂત અને ભરાવદાર હાડકાની રૂચના કરી શકાય અને તેને સારી સ્થિતિમાં જાળવી શકાય.

વિટામિન ડી એ પોષકતત્ત્વ છે જે સૂર્યપ્રકાશની હાજરીમાં ત્વચા નીચે તૈયાર થાય છે અને કેટલાંક આહારોમાં પણ તે મળી આવે છે. જરૂર માંથી કંલિશાયમને શોખવા માટે વિટામિન ડી અગત્યનું છે. હાડકાની અને દાંતને સ્વસ્થ રાખવા માટે કંલિશાયમ અગત્યનું છે. જો તમારો આહાર કંલિશાયમથી સમૃદ્ધ હોય પરંતુ વિટામિન ડી પૂરતા પ્રમાણમાં ન હોય તો કંલિશાયમ શરીરમાં શોધાતું નથી. વિટામિન ડી તંદુરસ્ત ડિફેન્સ સિસ્ટમ પણ જાળવી રાખે છે, બલક્ય પ્રેશરમાં સુધારો કરે છે અને અમુક પ્રકારના કંન્સરના જોખમમાં પણ ઘટાડો કરે છે.

- 70 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ~1,000 મિગ્રા કંલિશાયમ અને 600 આઈચ્યુ વિટામિન ડીઓની ઈનિક જરૂર હોય છે.
- 70 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં 1,200 મિગ્રા કંલિશાયમ અને 800 આઈચ્યુ વિટામિન ડીઓની ઈનિક જરૂર હોય છે.

જો તમારી ઈનિક જરૂરિયાતો પૂરી કરવા તમારો આહાર સમર્થ ન હોય તો તમારા ડૉક્ટર તમને કંલિશાયમ અને વિટામિન ડી પૂર્કોની ભલામણ કરી શકે છે.



### વિટામિન ડી ભેણવવાના સોતો<sup>1</sup>

| સોત                        | વિટામિન ડીની માત્રા (આઈધુ) |
|----------------------------|----------------------------|
| કોડ લીવર ઑઇલ (1 મોટી ચમચી) | 1360                       |
| સેલમન માઇલી (85 ગ્રા)      | 447                        |
| ટુના માઇલી (85 ગ્રા)       | 154                        |
| દૂધ (1 કપ)                 | 115-124                    |
| દંડાનો અર્ક (1 મોટું)      | 41                         |

### કંશિયમ ભેણવવાના સોતો<sup>2</sup>

| દૂધ અને દૂધા ઉત્પાદનો          | કંશિયમની માત્રા (મિગ્રા) |
|--------------------------------|--------------------------|
| ગાયનું દૂધ (250 મિલી)          | 300                      |
| લેંસનું દૂધ (250 મિલી)         | 525                      |
| માવો (25 ગ્રા)                 | 239                      |
| ચીજ સલાઈસ (20 ગ્રા)            | 158                      |
| દર્દી (ગાયના દૂધનું) (1 વાટકી) | 149                      |

| કઠોળ                                | કંશિયમની માત્રા (મિગ્રા) |
|-------------------------------------|--------------------------|
| શરી (નાચણી) (25 ગ્રા)               | 75                       |
| બેંગાલ ગ્રામ (કાળા ચાણાં) (25 ગ્રા) | 72                       |
| રેટ બીન (રાજમા) (25 ગ્રા)           | 65                       |
| સોયાબીન (25 ગ્રા)                   | 60                       |

| પશુ ઉત્પાદનો         | કંશિયમની માત્રા (મિગ્રા) |
|----------------------|--------------------------|
| રોહુ માઇલી (25 ગ્રા) | 160                      |


| લીલા પાનવાળા શાકબાજુ | કંશિયમની માત્રા/100 ગ્રામ |
|----------------------|---------------------------|
| ચોળી (1 વાટકી)       | 397                       |
| મેથી (1 વાટકી)       | 395                       |
| સરસો (1 વાટકી)       | 155                       |
| બથુઆ (1 વાટકી)       | 150                       |

| સૂકો મેવો અને બીથા | કંશિયમની માત્રા/100 ગ્રામ |
|--------------------|---------------------------|
| અંજુર (5 આખા)      | 95                        |
| તલ (25 ગ્રામ)      | 363                       |

Adapted from:


- National Institutes of Health, 2016.
- J. Midlife Health, 2013;4(2):107-26.





પૂરતા પ્રમાણમાં સુરક્ષિત રીતે સૂર્યપકાશ મેળવીને, આહાર ક્ષારા કે પછી પૂરક તત્વો ક્ષારા વિટામિન ડીનો પર્યાપ્ત પુરવઠો જાળવી રાખો.


હાડકાં માટે અને સામાન્ય સ્વાસ્થ્ય લાભ બંને હેતુસર સંતુલિત, પોષણાયુક્ત આહાર માણાતા રહો જેમાં પૂરતું પ્રોટીન અને પુષ્કળ તાજા ફળો તમ જ શાકભાજુ સામેલ હોય.



શરીરનું આરોગ્યપદ વજન જાળવી રાખો કેમ કે વજન ઓછું હોવું એ ઓસ્ટીઓપોરોસિસ માટે જોખમી પરિબળ બને છે.




ધૂમપાન બંધ કરો કેમ કે તે હાડકાની રચના કરતા ક્ષાંખોની કામગીરીને અવરોધે છે અને ફેક્ચર થવાના જોખમમાં વધારો કરે છે.



આલકોહોલનું વધુ સેવન કરવાનું ટાળો કેમ કે વધુ પડતું સેવન થાપા અને અન્ય ઓસ્ટીઓપોરોટિક ફેક્ચર્સના અતિરિક્ત જોખમ સાથે સંકળાયેલ છે.



મીઠું અને કેકેનનો ઉપયોગ સીમિત કરો કેમ કે આ શરીર માંથી કંલિયમની હાનિને પ્રોત્સાહિત કરી શકે છે, ખાસ કરીને જો કંલિયમનું સેવન અપૂર્ણ હોય.



## સ્વ-સંભાળ

વયસ્ક લોકોમાં હાડપિંજરની ભંગુરતા અને પડી જવાના અતિરિક્ત જોખમને લીધે ફેફ્ચર્સ થાય છે. વયસ્ક લોકોમાં પડી જવાના જોખમી પરિબળોમાં સ્નાયુઓની નબળાઈ, પોસ્ટરલ અક્ષમતા, દાઢિની ખાખી, કેટલીક દવાઓનો ઉપયોગ જેણાથી ચક્કર આવે અને ઘેન રહે તેમ જ ઈનડોર અને આઉટડોર જોખમો સામેલ છે. એકવાર એક ફેફ્ચર થથા પછી બીજું ફેફ્ચર થથાની શક્યતા જેને કોઈ ફેફ્ચર ન થયું હોય તેની તુલનાએ અનેકગાળી વધી જાય છે.

## પડી જવાથી બચાવના સૂચના




નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરો, જેમાં સંતુલન, તાકાત અને પોશ્યર માટેની કસરતો સામેલ છે.

સંતુલન માટે જો જરૂર જણાય તો કોઈ આધાર (વૉકર, લાકડી) નો ઉપયોગ કરો.




તમારી આંખોની નિયમિત તપાસ કરવતા રહે.



જો તમને ચક્કર આપતા હોય થઅવા ક્યારેય અસ્થિરતાનો અનુભવ કરતા હો તો તમારા ડૉક્ટર સાથે વાત કરો. તમારા ડૉક્ટર સાથે બધી જ દવાઓની નિયમિત સમીક્ષા કરતા રહે.

પહોળી હિલ અને લપસે નહીં એવા સોલ ધરાવતા શૂઝ પહેરો. પગને સારો આધાર આપતા શૂઝ પસંદ કરો.



જો તમે ચશ્મા પહેરતા હો તો તમે તેનો નિર્દેશાનુસાર ઉપયોગ કરો એ સુનિશ્ચિત કરશો.

### ધરમાં પડી જવાના સામાન્ય જોખમોને દૂર કરો:

**ફરસ:** ફરિયારને તેની રાબેતા મુજબની જગ્યાએ રાખવા પ્રયત્ન કરો, કોઈસ, છૂટા વાયરો અને કલટર દૂર કરી દો. ચટાઈ અને ટુંછિણિયા બરાબર કિક્સ કર્યા હોય અને સ્મૂધ હોય તે ખાતરી કરી લો.





### બાથરુમની લાઇટિંગ:

બાથરુમમાં હેન્ડરેઇલ અને લપસે નહીં એવી મેટ અથવા નળ લગાડો.

### દાદરાં:

દાદરાં, પ્રવેશ ક્ષાર અને હોલ્સમાં પૂરતો પ્રકાશ રાખો. જો તમે રાત્રે ઉઠો તો લાઇટ ચાલુ કરી દો.

### દાદરાં:

ચોખ્ઝો પ્રકાશ હોય તે સુનિશ્ચિત કરો,  
હેન્ડરેઇલ સલામત હોય તે ચકાસી લો.



ઓસ્ટીઓપોરોસિસ વિશે વધુ માહિતી માટે તમે નીચે જણાવેલી લિંક્સ પર  
મુલાકાત કરી શકો છો:

1. [www.medicinenet.com/osteoporosis](http://www.medicinenet.com/osteoporosis)
2. [www.nof.org](http://www.nof.org)
3. [www.osteoporosis-info.com](http://www.osteoporosis-info.com)
4. [www.osteoporosisindia.com](http://www.osteoporosisindia.com)
5. [www.orthoinfo.aaos.org](http://www.orthoinfo.aaos.org)
6. [www.nos.org.uk](http://www.nos.org.uk)
7. [www.arc.org.uk](http://www.arc.org.uk)
8. [www.iofbonehealth.org](http://www.iofbonehealth.org)
9. [www.nih.gov/](http://www.nih.gov/)
10. [www.familydoctor.org](http://www.familydoctor.org)



**Disclaimer:** Information mentioned herein is only for general awareness purpose and NOT intended nor implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. Please consult your doctor before starting any treatment / medicine/ in case of any health issues or existing medical conditions. Any advice regarding the management of the any medical condition is totally in the discretion of your doctor/ Medical specialist.